

જનસંપર્ક અધીકારી દ્વારા
પોલીસ કમિશનરશ્રીની કચેરી, અમદાવાદ શહેર
ટેલીફોન નંબર ૨૫૬૩૩૩૩૩
કંટ્રોલરૂમ ટેલી.નં. ૨૫૬૩૦૧૦૦, ૨૫૬૩૦૨૦૦, ૨૫૬૩૦૪૦૦ ફેક્સ: ૨૫૬૩૦૬૦૦

તા.૦૪/૦૬/૨૦૧૭ રવિવાર

અમદાવાદ શહેર પોલીસ સમાચાર

નશાબંધી તથા જુગારધારા હેઠળ ઝડપાયા :-

સમાચાર યાદી નં.૧૧૫૫/૧૭

શહેર પોલીસે ગઈકાલે નશાબંધી ધારા હેઠળ ૩૦ કેસ કરી ૨૩ વ્યક્તિઓને ઝડપી, ૧૩૫૬ લીટર દેશી દારૂ અને ૬૧ બોટલ ઇંગ્લીશ દારૂ કબજે કર્યો છે. તેમજ જુગારધારા હેઠળ ૦૪ કેસ કરી, ૩૧ વ્યક્તિઓને ઝડપી રોકડ રૂપિયા ૯૩,૮૧૦/- અને જુગારના સાધનો કબજે કર્યા હતા.

તકેદારીના પગલા હેઠળ ઝડપાયા:-

સમાચાર યાદી નં.૧૧૫૬/૧૭

શહેર પોલીસે ગઈકાલે તકેદારીના પગલા હેઠળ સી.આર.પી.સી.૧૦૭,૧૦૯,૧૧૦,૧૫૧ મુજબ કુલ ૨૪૬ વ્યક્તિઓની અટકાયત કરી હતી. તેમજ પ્રો.ઈ.૯૩ મુજબ ૧૬ વ્યક્તિઓની અને પાસા હેઠળ ૦૩ વ્યક્તિઓની અટકાયત કરી હતી.

ચોરી:-

સમાચાર યાદી નં.૧૧૫૭/૧૭

વાડજ : ચંપાબેન રતિલાલ વસાવા (રહે, વિશ્રામ પાર્ક ભાવસાર હોસ્ટેલ સોસાતટી, નવા વાડજ) એ તા.૩/૬/૧૭ નારોજ વાડજ પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે તા.૧/૬/૧૭ કલાક ૫/૩૦ થી ૧૦/૪૫ વાગ્યા દરમ્યાન રાજપીપળાથી રાણિપ બસ સ્ટેન્ડ સુધીની રાજપીપળા-ભાખરી રૂટની બસની મુસાફરી દરમ્યાન કોઈ અજાણી વ્યક્તિ ચંપાબેનના સોનાના દાગીના તથા રોકડ રૂપિયા ૫૦૦/- મળી કુલ રૂપિયા ૧,૨૮,૦૦૦/- મતાની ચંપાબેનના થેલામાંથી ચોરી કરી લઈ ગઈ છે. આ ગુનાની તપાસ હે.કો.શ્રી સુરપાલસિંહ અજીતસિંહ ચલાવે છે.

શાહીબાગ : દેવાંગ નટવરલાલ પટેલ (રહે, મંગલમુર્તી એપર્ટમેન્ટ, નારણપુરા ટેલીફોન એક્સચેન્જ પાસે નારણપુરા) એ શાહીબાગ પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે તા.૨/૬/૧૭ સાંજના ૪/૦૦ થી રાતના ૧૧/૪૫ વાગ્યા દરમ્યાન શાહીબાગ સિવિલ કેમ્પસ પી.એમ.રૂમ તથા ટ્રાંઝીક વોર્ડ વચ્ચેની ગલીમાં રોડ ઉપર પાર્ક કરેલ પોતાની સેન્ટ્રો ગાડીનો ડાબી સાઇડનો કાચ તોડી, અજાણી વ્યક્તિ કારના ડ્રોવરમાંથી રોકડા રૂપિયા ૩૦,૦૦૦/- ચોરી કરી લઈ ગઈ હતી. આ ગુનાની તપાસ પો.સ.ઈ.શ્રી જે.એલ.ચૌહાણ ચલાવે છે.

સોનાની ચેઈન ખેચી તોડી લઈ ગયા:-

સમાચાર યાદી નં.૧૧૫૮/૧૭

સરદારનગર: ભગવતીબેન વા/ઓ મફતલાલ પટેલ (ઉ.વ.૩૪)(રહે,પર્ણકુંજ સોસાયટી વિભાગ-૩ ઉમેશનગરની પાછળ, કૈલાશ સ્કુલની બાજુમાં મેઘાણીનગર) તા.૨/૬/૧૭ સવારના ૬/૩૦ વાગ્યાના સુમારે હાંસોલ અવસર પાર્ટી પ્લોટ સામેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે મોટર સાયકલ ઉપર આવેલ પુરૂષ ભગવતીબેન ના ગળામાંથી સોનાની ચેઈન કિંમત રૂપિયા ૫૦,૦૦૦/- ખેચી તોડી લઈ નાસી ગયો હતો. આ અંગેની ફરીયાદ ભગવતીબેન પટેલે સરદારનગર પોલીસ સ્ટેશન ખાતે નોંધાવી છે. આ ગુનાની તપાસ પોઈ.શ્રી એચ.બી.ઝાલા ચલાવે છે.

પાણીની ટાંકીમાં પડી જતાં મૃત્યુ:-

સમાચાર યાદી નં.૧૧૫૯/૧૭

દાણીલીમડા : મો.અલકેઝ સ/ઓ દાનીસ રંગરેજ (ઉ.વ. ૦૩ વર્ષ)(રહે, ન્યુ ફેઝલનગર બોમ્બે હોટલ દાણીલીમડા) તા.૩/૬/૧૭ બપોરનાં ૧/૦૦ વાગ્યાનાં સુમારે પોતાનાં ઘરે રમતા-રમતા પાણીની ટાંકીમાં પડી જતાં સારવાર માટે તેને વા.સા.હોસ્પિટલમાં લઈ જતાં, ફરજ પરના ડો.શ્રી.એ તેને બપોરનાં ૧/૪૫ વાગ્યે મૃતજાહેર કર્યો હતો. આ અંગે દાણીલીમડા પોલીસે અકસ્માત મોત નોંધી આ અંગેની તપાસ હે.કો.શ્રી કાન્તીભાઈ પુંજાભાઈ ચલાવે છે.

આત્મહત્યા:-

સમાચાર યાદી નં.૧૧૬૦/૧૭

દાણીલીમડા : મહેશભાઈ કેશવભાઈ સોલંકી (ઉ.વ.૪૩)(રહે, આંનદપાર્ક સોસાયટી દેના બેન્કની સામે દાણીલીમડા) એ પોતાને નોકરી મળેલ ના હોય અને ચારેક વર્ષથી માનસિક તનાવમાં રહેતાં હોઈ તા.૩/૬/૧૭ કલાક ૫/૪૫ પહેલા કોઈપણ સમયે પોતાના ઘરે બારીની લોખંડની ગ્રીલ સાથે દોરી બાંધી ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. આ અંગે દાણીલીમડા પોલીસે અકસ્માત મોત નોંધી આ અંગેની તપાસ હે.કો.શ્રી પ્રધાનજી ખેંગારજી ચલાવે છે.

નાયબ પોલીસ કમિશનર,
કંટ્રોલરૂમ, અ'વાદ શહેર.
પોલીસ કમિશનર વતી.